



# Gujarat Chamber of Commerce & Industry



**Pathik Patwari**  
President

**Ajay Patel**  
Sr. Vice President

**Yogesh Parikh**  
Vice President

**Anil Jain**  
Hon. Secretary

**Dilip Padhya**  
Hon. Secretary (R)

**Apurva Shah**  
Hon. Treasurer

ગુજરાત વેપારી મહામંડળ

11<sup>th</sup> October, 2022 128309

To,

**Shri J.P Gupta, IAS**  
Principal Secretary  
Finance Department  
Govt. of Gujarat  
Sachivalaya, Gandhinagar

**Sub: Pending issues related to Finance Department**

Respected Sir,

Greetings from Gujarat Chamber of Commerce and Industry (GCCI).

The Office Bearers and representatives of Gujarat Chamber of Commerce and Industry had a meeting with Hon'ble Minister of State for Industries, Shri Jagdishbhai Vishwakarma; Hon'ble Minister of Energy and Finance Shri Kanubhai Desai and Hon'ble Minister for Forest and Environment Shri Kiritsinh Rana to discuss about pending issues related to Industries and Trade of Gujarat.

As discussed during the meeting, we had sent pending issues related to your department, with a request to resolve the same. We hereby request your kind consideration of the issues, in order to facilitate Ease of Doing Business and provide handholding to the trade and industries of Gujarat. We are hereby resending issues for your kind reference.

We look forward to your positive intervention in the matter.

With warm regards,

**Pathik Patwari**  
President.

**Copy to :**

1. Shri Kanubhai Desai, Hon'ble Minister for Energy and Finance, Govt. of Gujarat
2. Shri Jagdishbhai Vishwakarma, Hon'ble Minister of State for Industries, Govt. of Gujarat

**Encl:** As mentioned above



ગુજરાત વેપારી મહામંડળ

# Gujarat Chamber of Commerce & Industry



Pathik Patwari  
President

Ajay Patel  
Sr. Vice President

Yogesh Parikh  
Vice President

Anil Jain  
Hon. Secretary

Dilip Padhya  
Hon. Secretary (R)

Apurva Shah  
Hon. Treasurer

29 સપ્ટેમ્બર, 2022 / 28203

પ્રતિ,  
શ્રી કનુભાઈ દેસાઈ  
માનનીય મંત્રીશ્રી  
નાણાં અને ઉર્જા વિભાગ  
ગુજરાત સરકાર  
ગાંધીનગર.

વિષય: આપશ્રી અને સંલગ્ન ઉચ્ચ અધિકારીઓ સાથે થયેલ મિટિંગમાં ચર્ચા મુજબ નાણાં વિભાગને લગતા પડતર પ્રશ્નો

માનનીય મંત્રીશ્રી,

સૌપ્રથમ ગુજરાત રાજ્યના વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન આપવા આપશ્રી દ્વારા જે સકારાત્મક પગલાંઓ લેવામાં આવ્યા છે તે બદલ આપશ્રીનો આભાર માનીએ છીએ. વધુમાં આપશ્રી તેમજ અન્ય માનનીય મંત્રીશ્રીઓ અને સંલગ્ન ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિસ્તૃત મિટિંગ યોજી વેપાર-ઉદ્યોગના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આપે આપનો અમૂલ્ય સમય ફાળવ્યો અને પ્રશ્નોના નિરાકરણ માટે સકારાત્મક અભિગમ દર્શાવ્યો તે બદલ આપનો ખુબ આભાર માનીએ છીએ.

મિટિંગમાં ચર્ચા થયા મુજબ નાણાં વિભાગને લગતા પ્રશ્નો આપશ્રીની જાણ સારું અત્રે મોકલાવીએ છીએ. આ પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ ખુબજ જરૂરી હોવાથી આપશ્રીને આ બાબતે સકારાત્મક નિર્ણય લેવા નમ્ર વિનંતી કરીએ છીએ.

આપનો,

પથિક પટવારી

પ્રમુખ.

બિડાણ: ઉપર મુજબ

નકલ રવાના: શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, માનનીય ઉદ્યોગ મંત્રીશ્રી(રાજ્ય કક્ષા), ગુજરાત સરકાર, ગાંધીનગર.

શ્રી જે. પી. ગુપ્તા, IAS, માનનીય અગ્ર સચિવ, નાણાં વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર.

શ્રી મિલિંદ તોરવણે, IAS, ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ, ગુજરાત.



1. નાણાં વિભાગ

અનું.	વિભાગ	મુદ્દો	સૂચિત સુધારો/ સ્પષ્ટીકરણ
1.1	નાણાં વિભાગ	<p>પ્રોફેશનલ ટેક્સનું પેમેન્ટ જુદી જુદી જગ્યાએ જ્યાં ઉદ્યોગ ચાલતો હોય ત્યાં નાના ગામોમાં કરવું પડે છે અને તે આખી પ્રોસેસ મેન્યુઅલ છે અને તેથી પેમેન્ટ કરવામાં મુશ્કેલી પડે છે અને સરકારને કોઈ સેન્ટ્રલાઇઝ રેકોર્ડ મળતો નથી. બીજા રાજ્યોમાં પ્રોફેશનલ ટેક્સનું પેમેન્ટ ઓનલાઇન થાય છે જે ખૂબ સહેલું છે તેમજ રાજ્ય સરકારના રેકોર્ડ ઓનલાઇન પ્રાપ્ત થઈ શકે છે.</p> <p>પ્રોફેશનલ ટેક્સમાં જુના પેમેન્ટો બાકી હોય તેવા ક્ષેત્રો માટે કોઈ રાહતભરી જોગવાઈ નથી.</p> <p>અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોમર્શિયલ પ્રોપર્ટી પર ટેક્સની ગણતરીના ફોર્મ્યુલામાં માલિક માટે occupancy factor(F4)ની વેલ્યુ 1 ગણવામાં આવે છે જ્યારે ભાડૂઆત માટે 2ની વેલ્યુ ગણાય છે. ટેક્સની ગણતરીના</p>	<p>ગુજરાતમાં પ્રોફેશનલ ટેક્સની પ્રક્રિયાને ઓનલાઇન કરવા તેમજ બાકી રહેલ રકમ માટે વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ લાગુ કરવા વિનંતી.</p> <p>ભાડૂઆત માટે પણ occupancy factor(F4)ની વેલ્યુ 1 ગણવામાં આવવી જોઈએ.</p>



ગુજરાત રાજ્યના વેપાર ઉદ્યોગો માટેના સુચનોનું સંકલન (સપ્ટેમ્બર, 2022)

અનું.	વિભાગ	મુદ્દો	સૂચિત સુધારો/ સ્પષ્ટીકરણ
1.2		<p>ફોર્મ્યુલામાં વિવિધ કોમર્શિયલ વપરાશ માટે અલગથી usage factor ગણવામાં આવે જ છે .આને કારણે ભાડુઆતને ઊંચો ટેક્સ ભરવો પડે છે અને તેના પર બિનજરૂરી આર્થિક ભારણ પડે છે.રહેણાંક પ્રોપર્ટી માટે 2014-15માં રાજ્ય સરકાર દ્વારા આ રુલ નાબૂદ કરવામાં આવ્યો હતો પરંતુ કોમર્શિયલ પ્રોપર્ટીમાં હજુ આ રુલ યથાવત છે.</p>	





## 2. GST

અનં.	વિભાગ	મુદ્દો	સૂચિત સુધારો/ સ્પષ્ટીકરણ
2.1	<p>GST - ખાદ્ય તેલ ઉદ્યોગ દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓ</p> <p>(આ મુદ્દો રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે છે.)</p>	<p>તાજેતરમાં GST કાઉન્સિલે તેની 47મી મીટિંગમાં નોટિફિકેશન નંબર 09/2022-CTR તારીખ 13મી જુલાઈ, 22 દ્વારા ખાદ્ય તેલના સપ્લાય માટે ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરના કારણે બિનઉપયોગી ઇનપુટ ટેક્સ ક્રેડિટ ના GST રિફંડને પ્રતિબંધિત કરવાનો નિર્ણય કર્યો.</p> <p>- ભારતીય બજારમાં ખાદ્ય તેલ ખૂબ જ આવશ્યક ઉત્પાદન છે. આનો ઉપયોગ ઘરો, હોટલ, રેસ્ટોરન્ટમાં અને વિવિધ પ્રકારના ખાદ્ય ઉત્પાદનોની તૈયારીમાં વ્યાપકપણે થાય છે.</p> <p>- અમે રજૂઆત કરવા માંગીએ છીએ કે GST કાઉન્સિલ દ્વારા લેવામાં આવેલ ઉપરોક્ત નિર્ણય ખાદ્યતેલના ઉત્પાદન કરતા એકમોને પ્રતિફળ અસર કરશે અને તેના પરિણામે અંતિમ વપરાશકારો/ગ્રાહકો માટે તેલના ભાવમાં વધારો થશે.</p> <p>- ઉત્પાદન કરતા એકમો પાસે કાચા માલ અને પેકિંગ સામગ્રીની ખરીદી પર ચૂકવવામાં આવતા GSTની મોટી સરપ્લસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ્સ (ITC) છે. તમામ પ્રકારના પેકિંગ મટિરિયલના</p>	<p>ખાદ્યતેલ માટે ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરને કારણે બિનઉપયોગી ITC ના રિફંડની મંજૂરી આપવા વિનંતી.</p> <p>આનાથી નાના ઉત્પાદન એકમોને ટકાવી રાખવા અને વૃદ્ધિ કરવામાં મદદ મળશે.</p> <p>વધુમાં, આનાથી ભાવ વધારો અને કુગાવા ને નિયંત્રણ માં રાખી શકાશે.</p>

અનં.	વિભાગ	મુદ્દો	સૂચિત સુધારો/ સ્પષ્ટીકરણ																																																				
		<p>ખર્ચમાં વધારો થવાથી, સંચિત બિનઉપયોગી ાટની રકમ પણ વધશે. આ ાટનો વેચાણ સામે ઉપયોગ કરી શકાતો નથી.</p> <p>- આ મુદ્દાને નીચેના ઉદાહરણ દ્વારા સમજી શકાય છે.</p> <table border="1" style="margin-left: auto; margin-right: auto;"> <caption>Cost structure (Amount in Lakhs)</caption> <thead> <tr> <th>Particulars</th> <th>GST Rate</th> <th>Value</th> <th>Input GST</th> <th>Output GST</th> <th>% of Total Cost</th> </tr> </thead> <tbody> <tr> <td>Raw Material</td> <td>5%</td> <td>800</td> <td>40.00</td> <td>-</td> <td>80%</td> </tr> <tr> <td>Packing Material &amp; Other Chemicals</td> <td>18%</td> <td>180</td> <td>32.40</td> <td>-</td> <td>18%</td> </tr> <tr> <td><b>Total</b></td> <td></td> <td><b>980</b></td> <td><b>72.40</b></td> <td>-</td> <td></td> </tr> <tr> <td>Profit</td> <td></td> <td>20</td> <td>-</td> <td>-</td> <td></td> </tr> <tr> <td>MRP Sale Price</td> <td>5%</td> <td>1,000</td> <td>-</td> <td>50.00</td> <td></td> </tr> </tbody> </table> <table border="1" style="margin-left: auto; margin-right: auto;"> <caption>Calculation of Blockage of Capital (Amount in Lakhs)</caption> <thead> <tr> <th>Particulars</th> <th>Rs.</th> </tr> </thead> <tbody> <tr> <td>Unutilised ITC</td> <td>= 72.40 - 50</td> </tr> <tr> <td>Total Turnover</td> <td>1,000</td> </tr> <tr> <td>Net ITC</td> <td>= 40 + 32.40</td> </tr> <tr> <td>Adjusted Total Turnover</td> <td>1,000</td> </tr> <tr> <td>Tax Payable</td> <td>50.00</td> </tr> <tr> <td>ITC on Raw Materials, Packing Materials and Chemicals</td> <td>= 40 + 32.40</td> </tr> <tr> <td>Blocked Refund</td> <td>72.40</td> </tr> </tbody> </table> <p>આશરે મીનીમમ 2%થી 3% ની કોસ્ટ (આશરે રૂ.75 થી 90 ડબ્બા દીઠ ) વધશે</p>	Particulars	GST Rate	Value	Input GST	Output GST	% of Total Cost	Raw Material	5%	800	40.00	-	80%	Packing Material & Other Chemicals	18%	180	32.40	-	18%	<b>Total</b>		<b>980</b>	<b>72.40</b>	-		Profit		20	-	-		MRP Sale Price	5%	1,000	-	50.00		Particulars	Rs.	Unutilised ITC	= 72.40 - 50	Total Turnover	1,000	Net ITC	= 40 + 32.40	Adjusted Total Turnover	1,000	Tax Payable	50.00	ITC on Raw Materials, Packing Materials and Chemicals	= 40 + 32.40	Blocked Refund	72.40	
Particulars	GST Rate	Value	Input GST	Output GST	% of Total Cost																																																		
Raw Material	5%	800	40.00	-	80%																																																		
Packing Material & Other Chemicals	18%	180	32.40	-	18%																																																		
<b>Total</b>		<b>980</b>	<b>72.40</b>	-																																																			
Profit		20	-	-																																																			
MRP Sale Price	5%	1,000	-	50.00																																																			
Particulars	Rs.																																																						
Unutilised ITC	= 72.40 - 50																																																						
Total Turnover	1,000																																																						
Net ITC	= 40 + 32.40																																																						
Adjusted Total Turnover	1,000																																																						
Tax Payable	50.00																																																						
ITC on Raw Materials, Packing Materials and Chemicals	= 40 + 32.40																																																						
Blocked Refund	72.40																																																						
2.2	GST- વેટ એમ્નેસ્ટી સ્કીમ	<p>કેન્દ્ર સરકારે સબકા વિશ્વાસ (લેગેસી ડિસ્ચુટ રિઝોલ્યુશન) સ્કીમ, 2019 (SVLDRS) તરીકે ઓળખાતા સર્વિસ ટેક્સ હેઠળ વારસાના કેસ માટે માફી યોજના પ્રદાન કરી છે.</p> <p>- આ યોજનાને મોટી સફળતા મળી. આ યોજનાને કારણે ઘણાં પડતર મુકદ્દમાઓ પૂર્ણ થયા છે.</p> <p>- તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્ય સરકાર પણ વેટ એમ્નેસ્ટી સ્કીમ લઈને આવી છે.</p>	<p>અમે ગુજરાતમાં પણ વેટ એમ્નેસ્ટી સ્કીમ લાવવા વિનંતી કરીએ છીએ. આનાથી VAT હેઠળ ચાલી રહેલા ઘણા મુકદ્દમાઓનો અંત લાવવામાં મદદ મળશે.</p> <p>આ યોજના અંતર્ગત કરદાતાઓને ટેક્સની રકમના 25% થી 50% સુધી માફી તેમજ વ્યાજ અને</p>																																																				



અનં.	વિભાગ	મુદ્દો	સૂચિત સુધારો/ સ્પષ્ટીકરણ
			પેનલ્ટી માફી આપવી જોઈએ.
2.3	GST- વર્કસ કોન્ટ્રાક્ટ સર્વિસ (આ મુદ્દો રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે છે.)	<p>- તાજેતરમાં GST કાઉન્સિલે તેની 47મી મીટિંગમાં ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરને તર્કસંગત બનાવવા માટે વિવિધ વર્કસ કોન્ટ્રાક્ટ અને બાંધકામ સેવાઓ પર GST દર વધારવાનો નિર્ણય કર્યો.</p> <p>- જો કે, આના પરિણામે હાલના સરકારી બાંધકામ કોન્ટ્રાક્ટ્સમાં કોન્ટ્રાક્ટની કિંમતના 6% વધારાના બોજમાં પરિણમ્યું કારણ કે તમામ રાજ્ય સરકારના કોન્ટ્રાક્ટ્સ ટેક્સની રકમના સમાવેશ સાથેના છે અને પરિણામે, કોન્ટ્રાક્ટરે 6% નો વધારાનો બોજ સહન કરવો પડશે.</p> <p>- કોન્ટ્રાક્ટરોએ 12% GSTને ધ્યાનમાં રાખીને કિંમત ટાંકી હશે. જો કે, 18-07-2022 થી સપ્લાયરને આવા કરાર પર 18% GST ચૂકવવો જરૂરી છે. આથી, સપ્લાયરને તેના ખિસ્સામાંથી 6% GST ચૂકવવો પડશે કારણ કે તે તેને પ્રાપ્તકર્તા પાસેથી વસૂલ કરી શકશે નહીં કારણ કે કરારની કિંમત GST સહિતની છે.</p>	<p>ચાલુ કોન્ટ્રાક્ટ ધારકો વધારાનો 6%નો બોજ સહન કરી શકશે નહીં.</p> <p>આ 6%નું વળતર આપવું જરૂરી છે.</p> <p>ઓનગોઈંગ કોન્ટ્રાક્ટ્સ માટે 12% જ GST રેટ રાખવા વિનંતી છે.</p>

અનું.	વિભાગ	મુદ્દો	સૂચિત સુધારો/ સ્પષ્ટીકરણ
2.4	GST- કષ્ટદાયક નોંધણી પ્રક્રિયા	<p>- કેટલીકવાર નોંધણી અરજી કેટલાક અપ્રસ્તુત આધારો પર નકારી કાઢવામાં આવી છે જેમ કે રાજ્યમાં જ્યાં નોંધણી લેવામાં આવી છે ત્યાં ડિરેક્ટર અથવા અધિકૃત સહી કરનારની હાજરી નથી.</p> <p>- કેટલીકવાર અધિકારી કેટલાક દસ્તાવેજો માંગે છે જે GST કાયદા હેઠળ નિર્ધારિત પણ નથી જેમ કે, લીઝ અથવા ભાડાના કેસમાં આપવામાં આવેલી પોલીસ સૂચનાની નકલ.</p> <p>- આધાર પ્રમાણીકરણ સાથે આખા નામની જોડણી અથવા કમમાં નજીવો તફાવત હોવાના કિસ્સામાં; આવી પ્રક્રિયા નિષ્ફળ જાય છે. આવી નિષ્ફળતાને કારણે રિફંડ મેળવવાપાત્ર રકમ વિભાગ દ્વારા બ્લોક કરી શકાય છે.</p>	<p>આનાથી ધંધામાં નુકસાન થાય છે. સરકાર "Ease of Doing Business" પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પરંતુ આ કષ્ટદાયક નોંધણી પ્રક્રિયાને કારણે સરકારનું ઉક્ત લક્ષ્ય પૂર્ણ થતું નથી.</p> <p>કેટલીક સૂચનાઓ (સ્ટાન્ડર્ડ પ્રોસિજર) અથવા ડિપાર્ટમેન્ટ્સના ઓફિસર્સને સ્પષ્ટતા આપવી જોઈએ અથવા નોંધણી લેવાની પ્રક્રિયાને સરળ બનાવી જોઈએ.</p> <p>ગ્રિવન્સ સેલ બનાવવા વિનંતી</p>
2.5	GST- રિફંડ માટે FOB મૂલ્ય vs. CIF મૂલ્ય (આ મુદ્દો રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે છે.)	<p>માલની નિકાસના હિસાબ પર બિનઉપયોગી ાટનું રિફંડ લાગુ કરવા માટે માલની નિકાસની કિંમત તરીકે કઈ રકમ ગણવામાં આવશે તે લાંબો અને ચર્ચાસ્પદ પ્રશ્ન છે.</p> <p>- તાજેતરમાં GST કાઉન્સિલે તેની 47મી મીટિંગમાં સ્પષ્ટ કર્યું છે કે માલની નિકાસનું મૂલ્ય, નિકાસના ખાતા પર બિનઉપયોગી ાટનું</p>	<p>રિફંડના દાવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે અમે આ સંદર્ભમાં સ્પષ્ટતા પ્રદાન કરવા વિનંતી કરીએ છીએ.</p> <p>આનાથી આ ચોક્કસ મુદ્દાની સ્પષ્ટતા લાવવામાં અને ભવિષ્યમાં બિનજરૂરી મુકદ્દમાઓને ટાળવામાં મદદ મળશે.</p>



અનં.	વિભાગ	મુદ્દો	સૂચિત સુધારો/ સ્પષ્ટીકરણ
		<p>રિફંડ લાગુ કરવા માટે, FOB મૂલ્ય અથવા ઇન્વોઇસ મૂલ્ય કરતાં ઓછું હોવું જોઈએ.</p> <p>- આ સુધારો ઉપરોક્ત નિયમો હેઠળ સ્પષ્ટીકરણ દાખલ કરીને કરવામાં આવ્યો હતો. આથી, ઉક્ત સુધારો 01-07-2017 એટલે કે પૂર્વવર્તી રીતે લાગુ થવો જોઈએ.. વધુમાં, ઝીરો-રેટેડ સપ્લાય તેમજ સમાયોજિત કુલ ટર્નઓવરની ગણતરી માટે પણ તે જ ધ્યાનમાં લેવામાં આવશે.</p>	
2.6	<p>GST ટ્રીબ્યુનલની રચના બાબતે</p> <p>(રાજ્ય સરકાર દ્વારા આ મુદ્દો કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરવા માટે છે.)</p>	<p>સામાન્ય લોકો ખુબજ પ્રશ્નો અનુભવે છે અને પેન્ડિંગ અપીલો છે જેનું નિરાકરણ ટ્રિબ્યુનલમાંથી જ મળી શકે છે.</p>	GST ટ્રીબ્યુનલની રચના કરવા વિનંતી